

MEHTA INTEGRATED FINANCE LIMITED

CIN - L65910GJ1985PLC007692

Date: 16/11/2024

To, BSE Limited Corporate Relationship Department PJ Towers, Fort, Dalal Street, Mumbai - 400 001

Sub.:- Unaudited Financial Results for the quarter & half year ended 30.09.2024–Publication of Advertisement in News Papers

#### Scrip Code: 511377

Dear Sir/Madam,

In continuation of our outcome of Board Meeting for Unaudited Financial Results for the quarter and half year ended on 30.09.2024 under Regulation 33 of SEBI(LODR) Regulations, 2015 submitted to the Exchange on 14.11.2024, please find enclosed herewith the copy of the Unaudited Financial Results for the quarter and half year ended 30.09.2024 advertisements published in English Edition (Free Press) and Regional Language (Gujarati Edition) (Lok Mitra)) for your information and Record.

Kindly take the same on record.

Thanking You,

Yours faithfully, For, Mehta Integrated Finance Limited



Kamleshbhai P. Patel Company Secretary & Compliance Officer

Enclosure: A/a

Registered Office : 3, Law Garden Apt., Scheme-1, Opp. Law Garden, Ellisbridge, Ahmedabad-380 006. Tel. : 0091-79-26561000, Mobile: 9377578519 Email : mifl\_in@yahoo.com, Website : www.mehtaintegratedfinance.com

#### FREE PRESS GUJARAT

#### Editorial

Editor : Mayur Bhatt

# **Divorce on the rise among** the rich and educated



Vinod Chandrashekhar Dixit Free-lance Journalist, Writer & Cartoonist (dixitpatrakar@yahoo.in)

Divorce , today, has gone to an average home which is generally the last line of that "The impact of divorce on long". Marriage is now no metropolis and in the smaller escape from unhappy marriages and assert their number of broken families has increased after became easy. live together, they have no

Society has treated divorce as other alternative but to called 'empty- shell thousand reasons for a marriage to break. But there marriage. As far as Hindus are is one more reason for a compromise. Marriages survive on account of moral fear. Change in attitudes towards divorce is a part of the process of secularization society.

concerned, the bond of matrimony was regarded as permanent bond and dissolution of marriage was generally not regarded as proper. When couples divorce,

Indian in Secularization refers to the declining influence of religion. Divorce is not a happy option for couples.

Marriage is considered to be an unbreakable union of life according to Hindu defence for any society like scriptures, regardless of its ours. It is rightly pointed out success or failure. Divorce means the termination of children can be deep and life marital relations. It means dissolution of the marital bond. longer a sacred word and Technically speaking, divorce divorces no longer a dirty one. means a decree of dissolution Marriages are changing of marriage. Divorce is a because women are process through which marital changing-both in the bond ceases to be in existence as per law and the couple can towns. A significantly growing no longer be called the divorce number of Indians are husband or the wife. Hindu flooding the divorce courts to marriage is regarded as sacred because it is a bond of indissoluble nature. In any newfound independence. The society when the married persons feel that they cannot

taboo for long. There are a dissolve the marriage. Divorce marriages, where the spouses is the final dissolution of live together but their marriages exist in name only. These legislations provided grounds for divorce and made divorce considerably easier.

According to the World Press review finding (1987), divorces are on the increase the greatest causality is not to such an extent that all the relationship but the major cities of India have had children. It also shows that to create 'reconciliation marriage is no longer a sacred bureaus" to help estranged word and divorce no longer a couples. For better or for dirty one. A marriage is a worse, divorce has become union of two families, not just the way out. The patitwo individuals. There have parmeshwar has rudely and been steady rises in divorce gradually been brought down rates in India throughout to earth. Moreover, most recent decades. The causes of children of divorced parents marital breakdown in the form lead a volleyball existence that of divorce or separation in is thrown from one side to the India are different from that other without a safety net for of the Western countries. their emotions. In many However, many factors are cases, men seeking divorce associated with the rise in are prepared to return whatever they have received divorce rate in India. The changing attitudes towards as dowry. The question is how have been to bring an end to this practice? institutionalized by various Will divorces continue for changes in laws which have ever? If so, a day will come made room for divorce. when our society as we see it Divorce legislations were today will cease to exit. (Binfluenced by the notion of 15 Jyoti-Kalash Society, suffering and unhappiness of Jodhpur Tekra, Satellite, the adults trapped in the so **Ahmedabad - 380 015**)

## Surat Shiv Puja Complex Fire Dilshan Gumasta Runs Spa Without License, Farrar Wasim Had To Close Gym Due To Udhana's Trainer Surat, Two Sikkimese to the information received spa salon was built from inside area of ??Surat city and has

women employees of Amritaya Spa and Salon died of suffocation when a fire broke out in the gym on the third floor of Shivpuja Complex in City Light area of ??Surat. In this whole matter where a complaint has been registered against gym manager Shahnawaz Wasim and spa

manager Dilshan. It has been

revealed that the spa manager

Dilshan Beddak was running

the spa without a clerk's

license. Not only this, the gym

manager Wasim has also

been in controversy before. In

the year 2023, gym trainer

Sohil was harassing the girl in

Wasim's gym at Udhana, in

which a police complaint was

against gym managers

Manslaughter complaint

After Shiv Puja Complex

fire incident, a manslaughter

complaint has been filed

against gym manager Wasim,

Shahnawaj and spa manager

Dilshan at Surat Umra police

also registered.

accused had not taken the clerk's license. Accused Shah Nawaz entered into a sublease agreement and gave a portion of the gym to Dilshan

have arrested Shahnawaz and Dilshan. But Wasim is still wanted. Waseem is the son of

had to close the gym because controversies before. He started of the trainer, now Umra police a gym in Udhana area. But due to controversy, the gym had to be closed. In the year 2023, a gym trainer was beaten to

2

#### SYMBOLIC POSSESSION NOTICE

GICICI Bank Branch Office: ICICI Bank LTD Office Number 201-B, 2ND Floor, Road No.1 Plot No-B3, WIFI IT PARK, Wagle Industrial Estate, Thane (West)- 400604

The undersigned being the Authorised Officer of ICICI Bank Limited under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (12) R/w Rule 3 of the Security Interest (Enforcement) rules 2002, issued demand notices upon the borrowers mentioned below, (on the underlying pool assigned to ICICI Bank by Dewan Housing Finance Ltd.) in relation to the enforcement of security with respect to a Housing Loan facility granted, pursuant to a loan agreement entered into between DHFL and the borrower, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

As the borrower failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken symbolic possession of the property described herein below in the exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of ICICI Bank Limited.

| Sr.<br>No.   | Name of the Borrower(s)/<br>Co-Borrower(s) (DHFL Old<br>LAN & ICICI New LAN)                            | Description of Property/<br>Date of possession  | Date of Demand<br>Notice/ Amount in<br>Demand Notice (₹) | Name<br>of<br>Branch |  |  |
|--|---|---|--|----------------------|--|--|
| 1.   | Praveen Kumar &<br>Gita Devi- (Old DHFL Lan No-<br>06400007101 & New ICICI<br>Lan No- QZRAJ00005036257) | Sub Plot No. 11/3, Tirupati Park-2, Near Sena<br>Nagar, R.S. No. 37/ Paiki 3, Plot No. 11 To<br>15, Dhinchada, Jamnagar- 361001/<br>November 11, 2024 | June 29, 2024<br>Rs.<br>22,94,661/-                      | Rajkot               |  |  |
| The above-mentioned borrowers(s)/ guarantors(s) are hereby given a 30 day notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules, 2002. |   |   |  |                      |  |  |
| Date : November 15, 2024<br>Place : Gujarat Authorized Office  |   |   |  |                      |  |  |

#### BHATIA'S' BHATIA COMMUNICATIONS & RETAIL (INDIA) LIMITED CIN: L32109GJ2008PLC053336

Regd Off: 132, Dr. Ambedkar Shopping Centre, Ring Road, Surat-395002

Website: www.bhatiamobile.com, mail: info@bhatiamobile.com, Ph: 9727714477

| _ | Extract of Unaudited Financial Re   |  |   |  | mount in Lak   | h except EF  |
|---|---|--|---|--|--|--|
|   | Particulars   | Quarter<br>ended 30 <sup>th</sup><br>September<br>2024 | Quarter ended<br>30 <sup>th</sup> June 2024 | Quarter<br>ended 30 <sup>th</sup><br>September<br>2023 | Half Year<br>ended 30 <sup>th</sup><br>September<br>2024 | Half Year<br>ended 30 <sup>th</sup><br>September<br>2023 |
|   |   | (Unaudited)  | (Unaudited)                                 | (Unaudited)  | (Unaudited)  | (Unaudited)  |
|   | Total Income from Operations*   | 10,732.223   | 10,481.856                                  | 9,435.582  | 21,214.079   | 19,142.530   |
|   | Net Profit / (Loss) for the period<br>(before Tax, Exceptional and/or<br>Extraordinaryitems)  | 490.808  | 471.307                                     | 332.545  | 962.116  | 800.460  |
|   | Net Profit / (Loss) for the period<br>before tax (after Exceptional and/or<br>Extraordinary items)  | 490.808  | 471.307                                     | 332.545  | 962.116  | 800.460  |
|   | Net Profit / (Loss) for the period<br>after tax (after Exceptional and/or<br>Extraordinary items)   | 365.748  | 364.565                                     | 247.335  | 730.314  | 604.822  |
|   | Total Comprehensive Income for<br>the period[Comprising Profit /<br>(Loss) for the period (after tax)<br>andOther Comprehensive<br>Income(after tax)] | 365.845  | 364.663                                     | 247.884  | 730.508  | 605.921  |
|   | Equity Share Capital  | 1251.520   | 1251.520                                    | 1251.520   | 1251.520   | 1251.520   |
|   | Reserves (excluding Revaluation<br>Reserve) as shown in the<br>Audited/Unaudited Balance Sheet of<br>the previous year *                              | -  | -   | -  | -  | -  |
|   | Earnings Per Share (face value of<br>Rs. 10/-each) (for<br>continuing and discontinued<br>operations)   |  |   |  |  |  |
|   | 1. Basic  | 0.292  | 0.291                                       | 0.198  | 0.584  | 0.483  |
| _ | 2. Diluted  | 0.292  | 0.291                                       | 0.198  | 0.584  | 0.483  |

1. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other disclosure Reguirements) Regulations, 2015. The full format of the

#### **Baroda BNP Paribas Mutual Fund** Launches Lakshya SIP

Paribas Mutual Fund has end of the chosen SIP period, introduced a wealth-building the accumulated investment is and regular income solution called Lakshya SIP-a combination of Systematic Investment Plan (SIP), and Systematic Withdrawal Plan (ŚWP), designed to help investors achieve their financial goals and help them get very timely as India's INR 67.25 regular monthly income. Lakshya SIP allows investors to saw inflows via SIP's jump 49% save systematically for varying periods-8, 10, 12, or 15 yearsthrough a monthly SIP in one www.amfiindia.com " Driven of the equity-oriented schemes by strong demography and offered by Baroda BNP Paribas supportive policy environment, Mutual Fund. These schemes are carefully selected to fastest growing major provide the potential for long- economy in the world.

Ahmedabad, Baroda BNP term wealth creation. At the switched into one of the five hybrid schemes of Baroda BNP Paribas Mutual Fund as per Investors Choice after which a pre-set Systematic Withdrawal Plan starts, providing a regular monthly income. The move is lakh crore mutual fund industry year on year in October 2024 to Rs 25,323 crore. Source India is expected to remain

Marengo CIMS Hospital Launches **Obesity & Wellness Centre** 



#### Mela continues for 10 days without any permission in Khambhat

this whole matter came out, Khambhat Even after the fire incident the police closed the fair late in the TRP game zone of this evening. It is worth Rajkot, the system seems to mentioning that this fact came be careless, now an incident out when the local corporators has come to light in Khambhat. of Khambhat presented the For the last 10 days in entire matter to the media. Khambhat, the fair was going The corporators have also on at Chakdol Ground without alleged that in the last two the permission of Roads and days, two people who came Buildings Department, Fire to the fair have died after NOC, Fitness, Province, suffering heart attacks and Municipality or Police. After vomiting.

Because, the spa manager Dilshan Surat did not even take the Gumasta's license to run the spa from Eighth Zone. running the spa as if it were his fieldom, running the lie that

the license had been burnt in a fire . He also lied to the police when he was questioned by the police about the Gumsta license. He said his clerk's license was burnt in the fire incident. However, according

| MEHTA INTEGRATED FINANCE LIMITED<br>CIN: L65910GJ1985PLC007692   |
|--|
| Reg. Off: 003, Law Garden Appartment, Scheme-1 , Law Garden, Ellisbridge,Ahmedabad – 380006<br>E-mail : 1mifl_in@gmail.com • Website: www.mehtaintegratedfinance.com • Ph: 079- 26561000 |
| Extract of Statememt of Standalone Unaudited Financial Results for<br>the Quarter and Half year ended 30/09/2024 (Rs. In Lakhs except 1  |

|     | (Rs. In Lakins except EPS)         |               |               |                 |            |  |  |  |
|-----|------------------------------------|---------------|---------------|-----------------|------------|--|--|--|
| Sr. | Particulars                        | Quarter ended | Quarter ended | Haif Year ended | Year ended |  |  |  |
| No. |                                    | 30/09/ 2024   | 30/06/2024    | 30/09/2024      | 31/03/2024 |  |  |  |
|     |                                    | (Unaudited)   | (Unaudited)   | (Unaudited)     | (Audited)  |  |  |  |
| 1   | Total income from operation(Net)   | 24.03         | 20.37         | 44.39           | 210.44     |  |  |  |
|     | Net profit / (loss) for the period | 11.74         | 1.51          | 13.25           | 154.39     |  |  |  |
| _ ۱ | (before tax, exceptional and / or  |               |               |                 |            |  |  |  |

station. At present, in the preliminary investigation, the police have found that the accused did not take the fire NOC even after receiving the notice as they did not have the fire department's NOC twice. The matter does not end here.

Gumasta was illegally

from the Eighth Zone, the the gym itself. Earlier Wasim been involved in similar to run the spa. A path to the Rauf, a builder in the Udhana death by cattle in Udhana area.

Ahmedabad, Marengo CIMS Hospital launched Obesity & Wellness Centre, a cutting-edge facility dedicated to providing specialized care for individuals facing obesity, diabetes, and metabolic disorders. This advanced centre represents a major advancement in tackling the pressing health challenges Nilesh of obesity in Gujarat. The multidisciplinary team is Obesity & Wellness Centre, guided by a team of highly experienced specialists offers comprehensive, personalized treatment plans tailored to each and supportive approach to patient's unique needs. The team of doctors includes Dr journey.(1-7)

Vivek Patel (Consultant Endocrinologist), Dr Rikin M Shah (Scope-Certified Obesity Specialist), Dr Abhilash Chokshi (Consultant Laparoscopic Surgeon), and Consultant Gastroen-terologists Dr Bhavesh Thakkar, Dr Rajeevkumar Bansal, and Dr Toke. This dedicated to providing holistic care that addresses both the **Place: Ahmedabad** physical and metabolic aspects Date: 14-11-2024 of obesity, ensuring a thorough each patient's health

#### E-AUCTION FOR THE CONTRACT OF 'TEA & REF. STALLS' RB's LETTER No. 2022/TC(FM)/10/04 dated : 29.07.2022 No. C 45/GEN/E-Auction

With reference to above, e-Auction for the contract of 'Tea & Ref. Stalls' has been nvited. The catalogue has already been published on IREPS website. The details are furnished as under -

| Catalogue<br>No.   | Type<br>of<br>Contract  | Lot No.  | Contract<br>Period | Lot End<br>Date Time  |  |
|--------------------|-------------------------|--|--------------------|---|--|
|                    |                         | Catg-RJT-RJT-SMU-7-24-1<br>(Catering -Special Minor<br>Unit (SMU))   |                    | e-Auction for all<br>Lots will start at<br>16:00 hours on   |  |
| E-CTG-<br>02-11-24 |                         | Catg-RJT-SUNR-SMU-8-24-1<br>(Catering -Special Minor<br>Unit (SMU))  |                    | 26-11-2024<br>Initial Cooling<br>Off Period is 30<br>minutes.   |  |
|                    | Tea &<br>Ref.<br>Stalls | Catg-RJT-SUNR-SMU-10-24-1<br>(Catering -Special Minor Unit<br>(SMU)) | 05<br>Years        | Successive Lot<br>Closing Interval<br>is 10 minutes.<br>Lot-wise Closing<br>Time can be<br>viewed in e- |  |
|                    |                         | Catg-RJT-HAPA-SMU-9-24-1<br>(Catering -Special Minor<br>Unit (SMU))  |                    |   |  |
|                    |                         | Catg-RJT-RJT-SMU-7-24-2<br>(Catering -Special Minor<br>Unit (SMU))   |                    | Auction module<br>of IREPS.   |  |
| like us on:        | faaabaa                 | k oomMostornBlue Followus on f                                       | M twittor          | RJT-118   |  |
| Like us on:        | f faceboo               | k.com/WesternRly • Follow us on:                                     | X twitter.         | com/WesternRly  |  |

|   | Net profit / (loss) for the period       | 11.74 | 1.51 | 13.25 | 154.39  |
|---|--|-------|------|-------|---------|
|   | before tax (after exceptional and / or   |       |      |       |         |
| 3 | extraordinary items)                     |       |      |       |         |
| 1 | Net profit / (loss) for the period after | 11.74 | 1.51 | 13.25 | 154.39  |
| 1 | tax (after exceptional and / or          |       |      |       |         |
| 4 | extraordinary items)                     |       |      |       |         |
|   | Total Comprehensive Income for the       | 11.74 | 1.51 | 13.25 | 154.39  |
|   | period comprising Profit(Loss) and       |       |      |       |         |
|   | Other Comprehensive Income for the       |       |      |       |         |
| 5 | period (after tax)                       |       |      |       |         |
| 6 | Paid up Equity Share Capital(Rs.10/-     | 500   | 500  | 500   | 500     |
| 7 | Other Equity                             |       |      |       | 1148.68 |
|   | Earning per share (Rs. 10/-each)         | 0.23  | 0.03 | 0.265 | 3.09    |
| 8 | Basic and Diluted                        |       |      |       |         |
|   |  |       |      |       |         |

#### Note:

Date :- 13-11-2024

Place :-Ahmedabad

1)The above is an extract of the detailed format of Unaudited Financial Results for the Ouarter and Half Year ended 30/09/2024 field with Stock Exchange under Rgulation 33 of the SEBI(Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015.

2)The full format of the same along with the notes is available on the website of Stock Exchange at www.bseindia.com and at the website of the Company at www.mehtaintegratedfinance.com

For, Mehta Integtated Finance Limited

Vishwesh D. Mehta Managing Director& CFO

(DIN: 00484785)

#### ASHISH POLYPLAST LIMITED

Regd.Office: 501, Fortune Business Hub, Nr.Shell Petrol Pump, Science City Road, Ahmedabad-380060 Phone : 9099052582, E-Mail: ashishpolyplast@gmail.com

CIN : L17110GJ1994PLC021391

Extract of Statement of Unaudited Financial Results for the Quarter and Six month ended September 30, 2024 (Rs in Lakhs Except Earning Per Share)

| Sr.<br>No. |  | Quarter<br>ended | Six month<br>ended | Quarter<br>ended | Year ended |
|------------|--|------------------|--------------------|------------------|------------|
|            | Particulars  | 30.09.2024       | 30.09.2024         | 30.09.2023       | 31.03.2024 |
|            |  | Unaudited        | Unaudited          | Unaudited        | Audited    |
| 1          | Total income from operations (net)   | 349.38           | 788.77             | 401.80           | 1,594.13   |
| 2          | Net Profit / (Loss) for the period (before Tax,<br>Exceptional and Extraordinary items)  | 40.98            | 86.42              | 18.02            | 97.54      |
| 3          | Net profit / (Loss) for the period before Tax (after<br>Exceptional and Extraordinary items)   | 40.98            | 86.42              | 18.02            | 97.54      |
| 4          | Net Profit / (Loss) for the period after tax (after<br>Exceptional and Extraordinary items)  | 29.15            | 62.51              | 15.03            | 84.16      |
| 5          | Total Comprehensive Income for the period<br>[Comprising Profit / (Loss) for the period (after tax)<br>and Other Comprehensive Income (after tax)] | 27.73            | 61.91              | 14.66            | 83.27      |
| 6          | Equity share capital (face value of INR 10)  | 339.75           | 339.75             | 339.75           | 339.75     |
| 7          | Reserve excluding Revalution Reserve   |                  |                    |                  | 308.38     |
| 8          | Earning per share (before and after extraordinary<br>items)<br>Basic & Diluted :   | 0.86             | 1.84               | 0.44             | 2.48       |

The above is an extract of the detailed format of Quarterly Financial Results filled with the stock exchanges under Regulation 33 of the SEBI (Listing and other Disclosure Requirements) Regulations 2015. The full format of Quarterly Financial Results are available on the Stock Exchange website www.bseindia.com and also on the Company's Website www.ashishpolvplast.com.

Above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors in their meeting held on November 13, 2024

By order of the Board Sd/ Ashish D Panchal Chairman & Managing Director DIN: 00598209

Quarterly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) at www.bseindia.com and the listed entity at www.bhatiamobile.com

2. The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on 13th November, 2024.

The Limited Review as required under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements Regulations, 2015 has been completed by the auditors of the Company.

Total income from operations includes only revenue from operations, other incomes are not considered.

For Bhatia Communications & Retail (India) Limited Sd/-Sanjeev Harbanslal Bhatia Managing Director

Date: 13-11-2024 DIN: 02063671

#### AMARNATH SECURITIES LIMITED

CIN No. L67120GJ1994PLC023254

Reg. office:- 1/104, Sarthak, Opp. C.T. Centre, B/H. Swastik Cross Road, C.G. Road, Ahmedabad - 38009. Corporate Office: Office No FC 20 2nd Floor Eternity, LBS Marg Near Teen Hath Naka Thane, Wagle I.E., Thane, Thane, Maharashtra, India, 400604

Statement of Unaudited Financial Results for Quarter and Half year ended 30th September 2024 (Rs. in Lacs)

| Sr.   |  | (                        | Juarter ende             | d                        | Half Yea                 | ar ended                 | Year ende               |
|-------|--|--------------------------|--------------------------|--------------------------|--------------------------|--------------------------|-------------------------|
| No.   | Particulars  | 30.09.2024<br>(Reviewed) | 30.06.2024<br>(Reviewed) | 30.09.2023<br>(Reviewed) | 30.09.2024<br>(Reviewed) | 30.09.2023<br>(Reviewed) | 31.03.2024<br>(Audited) |
| 1     | Revenue from operations  | 9.80                     | 9.71                     | 9.67                     | 19.51                    | 19.86                    | 40.87                   |
|       | Other income   | -                        | -                        | 0.05                     | -                        | 0.05                     | 0.0                     |
|       | Total revenue  | 9.80                     | 9.71                     | 9.72                     | 19.51                    | 19.91                    | 40.9                    |
| 2     | Expenses   |                          |                          |                          |                          |                          |                         |
|       | Employee benefits expense  | 0.90                     | 0.90                     | 1.05                     | 1.80                     | 2.10                     | 3.4                     |
|       | Finance Costs  | 0.52                     | 0.50                     | 0.82                     | 1.02                     | 2.08                     | 3.0                     |
|       | Depreciation and amortization expense  | -                        | -                        | -                        | -                        | -                        |                         |
|       | Other expenses   | 1.62                     | 1.55                     | 0.91                     | 3.17                     | 6.09                     | 8.2                     |
|       | Total expenses   | 3.04                     | 2.95                     | 2.78                     | 5.99                     | 10.28                    | 14.7                    |
| 3     | Profit/(Loss) from Exceptional Items<br>before tax (1-2)   | 6.76                     | 6.76                     | 6.94                     | 13.53                    | 9.63                     | 26.2                    |
| 4     | Exceptional Items  | -                        | -                        | -                        | -                        | -                        |                         |
| 5     | Profit/(Loss) before tax   | 6.76                     | 6.76                     | 6.94                     | 13.53                    | 9.63                     | 26.2                    |
| 6     | Tax expense:   |                          |                          |                          |                          |                          |                         |
|       | (1) Current tax  | 1.80                     | 1.84                     | 1.86                     | 3.63                     | 2.58                     | 7.4                     |
|       | (2) Deferred tax   |                          | -                        | -                        | -                        | -                        |                         |
| 7     | Profit/(Loss) from ordinary activities after tax   | 4.96                     | 4.93                     | 5.08                     | 9.89                     | 7.05                     | 18.7                    |
| 8     | Other Comprehensive Income (OCI)<br>Item that will be reclassified to profit or loss<br>Gain/(Loss) on recognised on fair valuation<br>of Financial Assets | -                        |                          | -                        | -                        | -                        |                         |
| _     | Income tax relating to these items   |                          | -                        | -                        |                          | -                        |                         |
| _     | Total Other Comprehensive Income (OCI)   |                          | -                        |                          | -                        | -                        |                         |
| 9     | Profit/(Loss) for the Period   | 4.96                     | 4.93                     | 5.08                     | 9.89                     | 7.05                     | 18.7                    |
| ,<br> | Paid up Equity Share Capital<br>(Face Value of Rs. 10 each)  | 300.02                   | 300.02                   | 300.02                   | 300.02                   | 300.02                   | 300.0                   |
| 10    | Earning Per Share (EPS) (Not annualised)   | 000.02                   | 000.02                   | 000.02                   | 000.0L                   | 000.0L                   | 000.0                   |
|       | (1) Basic  | 0.17                     | 0.16                     | 0.17                     | 0.33                     | 0.24                     | 0.6                     |
| _     | (2) Diluted  | 0.17                     | 0.16                     | 0.17                     | 0.33                     | 0.24                     | 0.6                     |

#### Notes

Place: Surat

1. The above Financial Results which are published in accordance with the regulation 33 of the Securities and Exchange Board Of India (Listing obligations & Disclosure Requirements) Regulations, 2015 have been reviewed and recommended by Audit Committee and has been approved by the Board of Directors at its Meeting held on Wednesday, November 13, 2024.

2. The statutory Auditors of the company have carried out the limited review.

3. The company has only one business segment.

|                  | For Amarnath Securities Limited |
|------------------|---------------------------------|
|                  | sd/-                            |
|                  | Naresh Padhir                   |
| Place: Ahmedabad | Whole-Time Diretor              |
| Dated:13.11.2024 | (DIN- 08379067)                 |

#### 15-11-2024 Friday લોકમિત્ર. LOKMITRA

તંત્રીશ્રીની કલમે

સંબંધ જરૂર સુધરશે,

# લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનો ૨૦૨૫ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં ચોખ્ખો નફો ૫૦.૦૩ કરોડ થયો <sup>3. ૫૦.૦૩ કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો વર્ષ ૨૦૨૪ના પહેલા અર્ધવાર્ષિક નફો નોંધાવ્યો છે જે નાણાંકીય વર્ષ ગાળામાં રૂ. ૬૮.૨૫ કરોડની એબિટ</sup>



અમદાવાદ,ડાયાબિટીસ બ્લડ અને કાર્ડિયોવેસ્ક્વુલર સ્વાસ્થ્યના સુગરના નિયંત્રણમાં ફેરફાર કરવા માટે એકસાથે સંચાલન પર ભાર મૂકે છે. જાણીતું છે, પરંતુ તેની અસર તેનાથી ઘણી આગળ વધે છેઃ તે હૃદય રોગના જોખમને બમણું કરે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડાયાબિટીસના દર્દીઓ. ખાસ કરીને ટાઈપ ૨. ડાયાબિટીસ વગરના લોકો કરતાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગોના હુમલાની શક્યતા બે થી ચાર ગણી વધારે છે. આ છે. આ, બદલામાં, સમય જતાં હૃદય જીવન-નિર્ણાયક જોડાણ પર ભાર મુકવા અને જાગૃતિ વધારવા માટે, અમદાવાદની અને સ્ટ્રોકની સંભાવનામાં વધારો કરી શેલ્બી હોસ્પિટલના ડોકટરો ડાયાબિટીસ શકે છે. (૪)

ડાયાબિટીસ અને હાર્ટ હેલ્થ વચ્ચેનું જોડાણ - ડાયાબિટીસ ધમનીઓમાં ઉન્નત બળતરા, હાઈ બ્લડ પ્રેશર અને પ્લેકના સંચય દ્વારા રક્ત વાહિનીઓના કાર્યોમાં ફેરફાર કરે છે. જેને એથરોસ્ક્લેરોસિસ કહેવામાં આવે પર તાણ લાવી શકે છે અને હાર્ટ એટેક

4

#### PREMIER SYNTHETICS LIMITED

Regd. Office : Surana House, Behind Klassic Chambers, Swastik X Rd, Opp. Narnarayan

|     |   | Q         | uarter Ende | d         | Half Yea  | r Ended    | Year |
|-----|---|-----------|-------------|-----------|-----------|------------|------|
|     |   |           |             |           |           | Ende       |      |
|     |   |           |             |           |           | 30.09.2023 |      |
| No. | Particulars                                       | Unaudited | Unaudited   | Unaudited | Unaudited | Unaudited  | Aud  |
| 1   | Total Income from Operations                      | 300.98    | 874.12      | 0.00      | 1175.10   | 0.00       | 808  |
|     | Net Profit/ (Loss) for the period before Tax from |           |             |           |           |            |      |
| 2   | continuing operations                             | 17.37     | (25.99)     | 0.00      | (8.61)    | 0.00       | 3    |
|     | Net Profit/ (Loss) for the period after Tax       |           |             |           |           |            |      |
| 3   | from continuing operations                        | 17.37     | (25.99)     | 0.00      | (8.61)    | 0.00       | 3    |
|     | Net Profit/(Loss) for the period before Tax       |           |             |           |           |            |      |
| 4   | from discontinued operations                      | (7.35)    | 55.46       | 34.23     | 48.11     | 6.02       | (11  |
|     | Net Profit/(Loss) for the period after Tax        |           |             |           |           |            |      |
| 5   | from discontinued operations                      | (7.35)    | 55.46       | 34.23     | 48.11     | 6.02       | (25  |
|     | Total Comprehensive Income for the period         |           |             |           |           |            |      |
|     | [Comprising Profit/ (Loss) for the period (after  |           |             |           |           |            |      |
|     | tax) and Other Comprehensive Income (after        |           |             |           |           |            |      |
| 6   | tax)]   | 10.02     | 29.47       | 34.23     | 39.50     | 6.02       | (22  |
|     | Equity Share Capital (Face Value per Share        |           |             |           |           |            |      |
| 7   | Rs.10/- each)                                     | 459.32    | 459.32      | 459.32    | 459.32    | 459.32     | 45   |
|     | Reserves (excluding Revaluation Reserve as        |           |             |           |           |            |      |
| 8   | shown in the Balance sheet of previous year)      | -         | -           | -         | -         | -          | 62   |
|     | Earning Per Share (of Rs. 10/- each) (for         |           |             |           |           |            |      |
| 9   | continuing and discountinued operations)          |           |             |           |           |            |      |
| 10  | Basic : from continuing operations                | 0.38      | (0.57)      | -         | (0.19)    | -          |      |
| 11  | Diluted :from continuing operations               | 0.38      | (0.57)      | -         | (0.19)    | -          |      |
| 12  | Basic : from discontinued operations              | (0.16)    | 1.21        | 0.75      | 1.05      | 0.13       | (    |
| 13  | Diluted : from discontinued operations            | (0.16)    | 1.21        | 0.75      | 1.05      | 0.13       | (    |
|     | Basic and Diluted Earning Per Share (EPS) -       |           |             |           |           |            |      |
| 14  | Continuing and Discontinued operations            | 0.22      | 0.64        | 0.75      | 0.86      | 0.13       | (4   |

Regulations, 2015. The full format of the said Financial Results are available on the Stock Exchange Website www.bseindia.con and on Company's website www.premiersyntheticsltd.com

|                  | For, Premier Synthetics Limited    |
|------------------|------------------------------------|
|                  | Sd/-                               |
| Place: Ahmedabad | Gautamchand Surana                 |
| Date: 14-11-2024 | Managing Director (DIN : 00955362) |

#### BHATIA'S' BHATIA COMMUNICATIONS & RETAIL (INDIA) LIMITED CIN: L32109GJ2008PLC053336

Regd Off: 132, Dr. Ambedkar Shopping Centre, Ring Road, Surat-395002 Website: www.bhatiamobile.com, mail: info@bhatiamobile.com, Ph: 9727714477

Extract of Unaudited Financial Result for the Quarter and Half Year ended 30th September, 2024 Amount in Lakh except EPS Particulars Ouarter Ouarter ended Ouarter Half Year Half Year ended 30<sup>th</sup> September 30<sup>th</sup> June 2024 ended 30th ended 30th ended 30th September September September 2024 2023 2024 2023 (Unaudited) (Unaudited) (Unaudited) (Unaudited) (Unaudited) 19,142.530 Total Income from Operations\* 10,732.223 10,481.856 9,435.582 21,214.079 962.116 Net Profit / (Loss) for the period 490.808 332.545 300.460 471.307 (before Tax, Exceptional and/or Extraordinarvitems) Net Profit / (Loss) for the period 490.808 471.307 332.545 962.116 800.460 before tax (after Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period 365.748 364.565 247.335 730.314 604.822

વાર્ષિક ધોરણે પ.૭૯ ટકા વધુ હતી. નાશાંકીય વર્ષ ૨૦૨૫ના પહેલા

હતી. નાણાંકીય વર્ષ ૨૦૨૫ના પહેલાં અર્ધવાર્ષિક ગાળામાં ઇપીએસ શેરદીઠ રૂ. ૨૪.૯૬ રહી હતી. ૩૦મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ)માં શેરધારકોએ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે શેરદીઠ રૂ. ૧.૮૦ (૧૮ ટકા)નું ડિવિડન્ડ મંજૂર કર્યું હતું. સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)એ કંપનીમાં તેમનો હિસ્સો સપ્ટેમ્બર ૨૦૨૩માં અર્ધવાર્ષિક ગાળામાં એબિટા રૂ. ૨.૫૯ટકાથી વધારીને ૫.૧૯ટકા કર્યો

સાંકેતિક કબ્જા નોટીસ શાખાનું સરનામું : આઈસીઆઈસીઆઈ બેંકલિ., ઓફીસ નં.૨૦૧-બી, બીજો માળ, રોડ નં.૧, પ્લોટ *f ICICI Bank* નં.બી.૩, વાઈફાઈ આઈટી પાર્ક, વાગલે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, થાણે (વેસ્ટ) -૪૦૦૬૦૪.

આથી સિક્યુરીટાઇઝેશન રિકંસ્ટુક્શન ફાઇનાન્સ એસેટ એન્ડ એનફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઓફ ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ના કાયદા ૧ ૩(૧૨) હેઠળ અને સિક્યોરિટી એક્ટ (એનફોર્સમેન્ટ)રૂલ્સ, ૨૦૦૨ના રૂલ ૩ સાથે વાંચતા આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ દારા નીચે જણાવેલા દેવાદરોને માંગણા નોટિસ આપવામાં આવી હતી. (દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા આઈસીઆઈસીઆઈ બેંને સોંપેલ પુલ અંતર્ગત)એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટીના અમલીકરણના સંબંધમાં, મંજૂર કરેલ હાઉસિંગ લોનની સુવિધાના સંદર્ભમાં દેવાદારો અને ડીએચએફએલની વચ્ચે થયેલા લોન કરાર અનસાર દેવાદારો ને નોટિસમાં જણાવેલી રકમ નોટિસ મલ્યાના ૬૦ દિવસની અંદર પરત કરવા અંગે જાણ કરવામાં આવે છે.

દેવાદારો બાકી લેણાં રકમ પરત કરવામાં નિષ્કળ ગયા છે. આથી જાહેર જનતા અને દેવાદારોને સચિત કરવામાં આવે છે કે સેક્શન ૧૩(૪) અને ઉપરોક્ત રુલ્સના રૂલ ૮ હેઠળ મલતાં અધિકારોની રૂએ નીચે જણાવેલી મિલકતોનો નીચે જણાવેલી તારીખે સાંકેતિક કબ્જો લઈ લેવામાં આવેલ છે. આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ પાસે મિલકતો ટાંચમાં હોઈ જાહેર જનતાને અને દેવાદારોને નીચે જણાવેલી મિલકતો સાથે કોઈ પણ જાતનો સોદો ન કરવા માટે તાકિદ કરવામાં આવે છે.

| 5  | (ડાઅચઅફઅલ જુના લન અન<br>આઇસીઆઇસીઆઇ નવા લેન)  | મિલકતોની વિગતો / સાંકેતિક કબ્જાની તારીખ  | ડિમાન્ડ નોટીસની<br>તારીખ / ડિમાન્ડ<br>નોટીસમાંની રકમ (રૂા) | શાખાનું<br>નામ |  |
|--|--|--|--|----------------|--|
| ٩  | પ્રવીશકુમાર અને ગીતા દેવી-<br>· (ડીએચએફએલજૂના લેન-06400007101<br>અને આઈસીઆઈસીઆઈ નવા લેન<br>QZRAJ00005036257) | સબ પ્લોટ નં. ૧૧ / ૩, તિરૂપતિ પાર્ક-૨, સેના નગર પાસે, આર.એસ. નં.<br>૩૭ / પૈકી ૩, પ્લોટ નં. ૧૧ થી ૧પ, ધિનચડા, જામનગર-૩૬૧૦૦૧ /<br>નવેમ્બર ૧૧,૨૦૨૪ | જૂન ૨૯, ૨૦૨૪<br>રૂા.<br>૨૨,૯૪,૬૬૧/-                        | રાજકોટ         |  |
| ઉપર જણાવેલા કરજદાર(રો)/ જામીનદાર(રો)અહીં બાકી નાણાં પરત કરી જવા માટે ૩૦ દિવસની નોટીસ આપવામાં આવેલ છે, જો નાણાં પરત |  |  |  |                |  |

કરવામાં નહીં આવે તો સિક્યુરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ- ૨૦૦૨ની કલમ ૮ અને ૯ નીજોગવાઈ મુજબ જામીન તરીકે મુકેલી મિલ્કતો આ નોટીસ પ્રસિદ્ધ થયાનાં ૩૦ દિવસ બાદ વેચી દેવામાં આવશે. અધિકત અધિકારી તારીખ: નવેમ્બર ૧૫, ૨૦૨૪

આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ

## અમરનાથ સિક્ચોરીટીઝ લિમીટેડ

CIN : L67120GJ1994PLC023254 રજીસ્ટર્ડ ઓફિસ : ૧/૧૦૪, સાર્થક, સી.ટી. સેન્ટરની સામે, સ્વસ્તિક કોસ રોડની પાછળ, સી.જી. રોડ, અમદાવાદ - ૩૯૦૦૦૯. કોર્પોરેટ ઓફિસ : ઓફિસ નં. એક્સી ૨૦, બીજો માળ, ઇન્ટરનીટી, એલબીએસ માર્ગ, તીન હાથ નાકાની પાસે, થાને, વાગલે આઈ.ઈ. થાશે, થાશે, મહારાષ્ટ્ર, ઈન્ડિયા - ૪૦૦૬૦૪.

૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ પૂરા થયેલા કવાર્ટર અને અર્ધ વર્ષ માટે અનઓડીટેડ નાણાંકીય પરિણામોના નિવેદનનો અર્ક

|     |   |                         |                         |                         |                         | (20                     | ક્રમ રૂપિયામાં         |  |
|-----|---|-------------------------|-------------------------|-------------------------|-------------------------|-------------------------|------------------------|--|
| Sr. | Derticulara   | કવાર્ટર સમાપ્ત          |                         |                         | અર્ધ કવાર્ટર સમાપ્ત     |                         | પૂર્શ થયેલ વર્ષ        |  |
| No. |   | ૩૦.૦૯.૨૦૨૪<br>(સમીક્ષા) | 30.05.૨૦૨૪<br>(સમીક્ષા) | 30.0૯.૨૦૨૩<br>(સમીક્ષા) | ૩૦.૦૯.૨૦૨૪<br>(સમીક્ષા) | ૩૦.૦૯.૨૦૨૩<br>(સમીક્ષા) | ૩૧.૦૩.૨૦૨<br>(સમીક્ષા) |  |
| 1   | કામગીરીમાંથી આવક  | 9.80                    | 9.71                    | 9.67                    | 19.51                   | 19.86                   | 40.8                   |  |
|     | અન્ય આવક  | -                       | -                       | 0.05                    | -                       | 0.05                    | 0.0                    |  |
|     | ર્કલ આવરુ   | 9.80                    | 9.71                    | 9.72                    | 19.51                   | 19.91                   | 40.9                   |  |
| 2   | ખર્ચાઓ  |                         |                         |                         |                         |                         |                        |  |
|     | કર્મચારી લાભ ખર્ચ                                       | 0.90                    | 0.90                    | 1.05                    | 1.80                    | 2.10                    | 3.4                    |  |
|     | નાણાંકીય ખર્ચ   | 0.52                    | 0.50                    | 0.82                    | 1.02                    | 2.08                    | 3.0                    |  |
|     | અમુલ્ચન અને ૠણમુકિત ખર્ચ                                | -                       | -                       | -                       | -                       | -                       |                        |  |
|     | અન્ય ખર્ચાઓ   | 1.62                    | 1.55                    | 0.91                    | 3.17                    | 6.09                    | 8.2                    |  |
|     | કુલ ખર્ચાઓ  | 3.04                    | 2.95                    | 2.78                    | 5.99                    | 10.28                   | 14.7                   |  |
| 3   | અસાધારણ વસ્તુઓ પહેલાં નફો / (નુકસાન)<br>અને ટેક્ષ (૧-૨) | 6.76                    | 6.76                    | 6.94                    | 13.53                   | 9.63                    | 26.2                   |  |
| 4   | અપવાદરુપ વસ્તુઓ   |                         |                         |                         | -                       | -                       |                        |  |
| 5   | કર પહેલાં નફો / (નુકસાન)                                | 6.76                    | 6.76                    | 6.94                    | 13.53                   | 9.63                    | 26.2                   |  |
| 6   | ટેક્ષ ખર્ચ  |                         |                         |                         |                         |                         |                        |  |
|     | (૧). હાલનો કર   | 1.80                    | 1.84                    | 1.86                    | 3.63                    | 2.58                    | 7.4                    |  |
|     | (૨). વિલંબીત કર   |                         | -                       | -                       | -                       | -                       |                        |  |
| 7   | કર પછીની સામાન્ય પ્રવૃતિઓમાંથી નફો/(નુકશાન)             | 4.96                    | 4.93                    | 5.08                    | 9.89                    | 7.05                    | 18.7                   |  |
| 8   | અન્ય વ્યાપક આવક (OCI)                                   |                         |                         |                         |                         |                         |                        |  |

## પણ... કેનેડા સુધરશે તો કેનેડાની રાજનીતિ સામે ભારતે કરડી દ્રષ્ટિ કરી છે. ભારત વિરોધી વલશ લઇને કેનેડાએ જે વિચિત્ર હરકતો કરવા માંડી છે તેનાથી ટુડો પર વૈશ્વિક સ્તરેથી વિવિધ ગમા-અણગમા ભર્યા પ્રતિભાવો સાંપડી રહ્યા હોવાનું પ્રતિત થાય છે. કેનેડાની માનસિકતા પરથ પડદો ઉઠી ચુક્યો છે, તેના વડા ટુડો ખેલ શરૂ કરાવી તેની ઉપર પડદો પાડવાની ચેષ્ટા કરે છે અને તેનાથી તેઓ વાજ આવી રહ્યા નથી. ટુડો ખાલિસ્તાની પરિબળોને છાવરે છે,

પ્રોત્સાહિત કરે છે, તેમને સારું લાગે તેવા નિવેદનો કરે છે અને જાહેરમાં તેનો વિરોધ દર્શાવી વૈશ્વિક સહાનુભૃતિ મેળવવા મથામણ કરે છે. આ પ્રક્રિયા જ કંઇક એવી છે કે, લોકોને તેમના આ વલણથી આશ્ચર્ય પણ થઇ રહ્યું છે. તેઓ પોતાના અધિકારનો ઉપયોગ સમાનતાના ધોરણને આગળ રાખીને કરતા નથી. હિન્દુ મંદિરો પર હુમલા થયા પછી ટડો જાગે છે, ઘર ફોડઓને પ્રોત્સાહિત આપીંને પાછળથી સૈનિકો દોડાવી કોઇને સસ્પેન્ડ કરે છે, તો કોઇ જુથને ચેતવણી પણ આપે છે. આ નીતિ બેવડા મુખવટાને પ્રસ્તુત કરે છે. કેનેડા હવે બીજુ મુખવટાને પ્રસ્તુત કરે છે. કેનેડા હવે બીજુ પાકિસ્તાન બનવા જઇ રહ્યું છે તેમની ગંદી ચેપ્ટાઓ જોઇને ઘર આંગણે પણ તેઓ બદનામ થઇ રહ્યા છે. તાજેતરમાં રાજનીતિક સ્તરે તેમનું રાજીનામું પણ માગવામાં આવી રહ્યું હતું. એક હકીકત એ છે કે, ટુડોનું ગણિત જ ગુંજવડા ભર્યું છે. તેમને હસવું છે પણ છે અને લોટ પણ ફાંકવો છે.

# મૈરિંગો CIMS હોસ્પિટલ દ્વારા અત્યાધુનિક ઓબેસિટી એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું



અમદાવાદઃ મૈરિંગો CIMS હોસ્પિટલ દ્વારા મેદસ્વીતા, ડાયાબિટીસ અને મેટાબોલિક ડિસઓર્ડર જેવા રોગો ધરાવતી વ્યક્તિઓ માટે વિશેષ સારવાર અને એક અદ્યતન સુવિધા સાથે ઓબેસિટી

ઓફર કરવામાં આવે છે. આ સેન્ટરના ડોકટરોની ટીમમાં ડો. વિવેક પટેલ (કન્સલ્ટન્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ), ડો. રિકિન એમ શાહ (સ્કોપ-સર્ટિફાઇડ ઓબેસીટી સંભાળ પુરી પાડવા માટે સમર્પિત સ્પેશિયાલિસ્ટ), ડો. અભિલાખ ચોકશી (કન્સલ્ટન્ટ લેપ્રોસ્કોપિક એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવામાં સર્જન). અને કન્સલ્ટન્ટ આવ્યું છે. આ અઘતન સારવાર કેન્દ્ર ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ તરીકે ડો. ગુજરાતમાં મેદસ્વીતાના ગંભીર ભાવેશ ઠક્કર, ડો. રાજીવકુમાર સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરવા બંસલ અને ડો. નિલ્લેનો સમાવેશ માટે એક અનન્ય પ્રગતિ છે. મેદસ્વીતા થાય છે. આ મલ્ટિડિસિપ્લિનરી ટીમ અને સુખાકારી માટેના આ કેન્દ્ર પર સર્વગ્રાહી સંભાળ આપવા માટે અત્યંત અનુભવી નિષ્ણાતોની ટીમ સમર્પિત છે જે મેદસ્વીતાના શારીરિક દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે, અને મેટાબોલિક બંને પાસાઓની અને દરેક દર્દીની અનન્ય સારવાર કરે છે, અને દરેક દર્દીના જરૂરિયાતોને અનુરૂપ તેઓને વ્યાપક સ્વાસ્થ્ય માટે સંપર્શ અને સહાયક અને વ્યક્તિગત સારવાર યોજનાઓ અભિગમ ઓફર કરે છે. (૧-૭)

## પ્રેમ, દગો અને વેરની વાર્તાઃ ડિઝની



અમદાવાદ, ભારતની અગ્રશી હેલ્થકેર કંપનીઓમાં સ્થાન ધરાવતી લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ પરા થતા નાણાંકીય વર્ષ ૨૦૨૫ના પહેલા અર્ધવાર્ષિક ગાળા માટે ૭૧.૫૦ કરોડ હતી હતી જે નાશાંકીય હતો.(૧૮-૨)

CIN-L70100GJ1970PLC100829

Complex, Navrangpura, Ahmedabad-380009, Gujarat

## હોટસ્ટારની ઠુકરા કે મેરા પ્યારનું ટ્રેલર રજૂ



પ્રેમમાં પડે છે. તેમનો પ્રેમ સામાજિક દબાણને કારણે ભંગ થાય છે. જેનાં પરિણામ વિનાશકારી આવે છે. આ સિરીઝ ખાસ ડિઝની હોટસ્ટાર પરથી ૨૨મી નવેમ્બર. ૨૦૨૪થી સ્ટીમ

અમદાવાદ. મહોબ્બત સે બદલે

થશે. પ્રેમ માટે કોઈ કેટલા દૂર જઈ શકે? સચિન પાંડે દારા ક્રિયેશન અને નિર્મિત, શ્રદ્ધા પાસી જયરથ દારા તક કા સફર ''ઠુકરા કે મેરા પ્યાર'' દિગ્દર્શિત અને કમલ પાંડે દારા રોચક નવી વેરની વાર્તા છે, જે લિખિત પીછો અને પ્રેમની આ ભારતની હૃદયભમિનો ધબકાર પડદા અસાધારણ વાર્તામાં નવોદિત ધવલ પર લાવી છે. જાતિ અને વર્ગની ઠાકુર અને સંચિતા બસુ સાથે પાર્શ્વભૂમાં સ્થાપિત આ પ્રેમ, દગો લોકપ્રિય કલાકારો અનિરુદ્ધ દવે અને વેરની વાર્તા દર્શકોને તેમની અને કપિલ કાનપુરિયા મહત્ત્વપૂર્શ બેઠક સાથે જકડી રાખશે. આ શો ભૂમિકામાં છે. ધવલ ઠાકુર કહે છે, શક્તિશાળી વાર્તા ગંથે છે, જ્યાં "કુલદીપનું પાત્ર અત્યંત કોપ્લેક્સ રોમાન્સ વેરમાં ફેરવાય છે અને દગો છે. તે બહુ સારો છે અને શયતાની વેર માટે રસ્તો તૈયાર કરે છે. કુલદીપ બાજુ પણ ધરાવે થછે. પાત્ર (ધવલ ઠાકુર) નીચલા વર્ગના ભાવનાત્મક રીતે પડકારજનક છે પરિવારનો હોશિયાર યુવાન છે, જે અને તેને જીવંત કરવા અને દર્શકો પ્રભાવશાળી ચૌહાર્શ પરિવારની માટે રિલેટેબલ બનાવવા ઘણી નીડર શાન્વિકા (સંચિકા બસુ)ના તૈયારીઓ કામે લાગી છે. (૧૯-૮)

| <b>ક્લિક્સ કેપિટલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ (ક્લિક્સ)</b><br>રજિસ્ટર્ડ ઓફિસઃ અગ્રવાલ કોર્પોરેટ ટાવર, પ્લોટ નં. 23, પાંચમો માળ, ગોવિંદ લાલ સિક્કા માર્ગ, રાજેન્<br>પ્લેસ, નવી દિલ્હી - 110008  | 24                                  |
|---|-------------------------------------|
| પઝેશન નોટિસ (પરિશિષ્ટ IV) નિયમ 8(1)   |                                     |
| જ્યારે ક્લિક્સ કેપિટલ સર્વિસીસ પ્રા.લિ. લિમિટેડ (ક્લિક્સ) ના અધિકૃત અધિકારી, એક નોન-બેંટિ<br>ફાઇનાન્સ્પિલ કંપની છે, જે યોગ્ય રીતે કંપનીઝ એક્ટ ૧૯૫૬ હેઠળ તેની રજિસ્ટર્ડ ઓફિસ: અગ્રવાલ કોપી<br>ટાવર, પ્લોટ નં. ૨૩, ૫ મો માળ, ગોવિંદ લાલ સિક્કા માર્ગ, રાજેન્દ્ર પ્લેસ, નવી દિલ્હી- ૧૧૦૦૦<br>સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિ<br>ઇન્ટરેસ્ટ એક્ટ 2002 (54 ઓફ 2002)ની જોગવાઈઓ હેઠળ (હવેથી તેને "એક્ટ" તરીકે ઓળખવામાં આવે<br>હેઠળ પ્રદાન કરવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને નીચે જણાવેલા ધિરાણકર્તાઓ અને સ<br>હિરાણકર્તાઓને નોટિસમાં ઉલ્લેખિત રકમ તારીખથી 60 દિવસની અંદર ચૂકવવા માટે ડિમાન્ડ નોટિસ જારી<br>હેઠળ પ્રદાન કરવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને નીચે જણાવેલા ધિરાણકર્તાઓ અને સ<br>ધિરાણકર્તાઓને નોટિસમાં ઉલ્લેખિત રકમ તારીખથી 60 દિવસની અંદર ચૂકવવા માટે ડિમાન્ડ નોટિસ જારી ક<br>હતી. ઋણલેનાર/ગેરેન્ટર રકમની ચુકવણી કરવામાં નિષ્કળ ગયા હોય, તો આ રીતે ઋણલેનાર અને સ<br>ધિરાણકર્તાઓને નોટિસમાં ઉલ્લેખિત રકમ તારીખથી 60 દિવસની અંદર ચૂકવવા માટે ડિમાન્ડ નોટેસ જારી ક<br>હતી. ઋણલેનાર/ગેરેન્ટર રકમની ચુકવણી કરવામાં નિષ્કળ ગયા હોય, તો આ રીતે ઋણલેનાર અને સા<br>ધિરાણકરાણી નિયમો ૨૦૦૨ ના નિયમ ૮ સાથે વાંચવામાં આવેલી કાયદાની કલય ૧૩ ની પેટ-કલમ (૪) હેઠ<br>તેને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલી મિલકતનો કબજો લીધો છે. ખાસ કર્ર<br>તેશન આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલી મિલકતનો કબજો લીધો છે. ખાસ કર્<br>દિવાણ લેનાર અને સામાન્ય રીતે જાહેર જનતાને આ દ્વારા સ્લિક્સ" ના ચાર્જને આધિન રહેશે અને તેના '<br>આપવામાં આવે છે અને મિલકત સાથેનો કોઈપણ વ્યવહાર "ક્લિક્સ" ના ચાર્જન આપલા સંબંધમાં હોગવાઈઓ '<br>આમંત્રિત કરવામાં આવે છે, જે સુરક્ષિત અસ્કયામતને રિડીમ કરવા માટે ઉપલબ્ધ સમયના સંબંધમાં હોય છે | રિંડ રહી છે (2) હતુ ન હ જોને શે ન ન |
| ઋણલેનાર/સહ-ઋણલેનારનું નામ અને સરનામું: ૧. જીગ્નેશ મોહનભાઈ પટેલ સ/ઓ મોહનભા<br>લીંબાભાઈ પટેલ, કાવ્યા ફ્લેટ નં. ૩૦૩, તિરૂપતિ મેઇન રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ- ૩૬૦૦૦૪<br>મોહનભાઈ લીંબાભાઈ રામાણી વ/ઓ લીંબાભાઈ રામજીભાઈ રામાણી, યોગીન શેરી નં.૧૪/૫<br>યોગીનગર, ગુરુગુલ પાસે, ગોંડલ રાજકોટ, ગોંડલ, ગુજરત- ૩૬૦૩૧૧ <b>૩. પટેલ મીનાબેન જીગ્નેશભાદ</b><br>૪ શ્રીધર એપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ નગર-ર, ગોકુલધામ પાસે, રાજકોટ , ગુજરત- ૩૬૦૦૦૬  | <b>2.</b>                           |
| <b>ડિમાન્ડ નોટિસ તારીખ :</b> ૨૦-૦૭-૨૦૨૪, <b>કબજાની તારીખ :</b> ૧૩-૧૧-૨૦૨૪,<br><b>ડિમાન્ડ નોટિસની રકમ :</b> ૨૦.૦૭.૨૦૨૪ ના રોજ રૂ. ૨૬,૯૧,૦૦૮.૦૬/-   | 1                                   |
| <b>ગુણધર્મની વિગતો :</b> તમામ ભાગ અને હિસ્સા સાથે નું રહેણાંક મકાન, પ્લોટ નં.૧૯પી, જમીન ૮૩-પ<br>ચોરસ મીટર, ગોંડલ, રેવન્યુ સર્વે નં.૫૯૭/૧-૨ અને ૫૯૮/૨-૪, જિલ્લો રાજકોટ, ગુજરા<br>(તા.૦૮-૦૨-૨૦૦૮ના રોજના વેચાણ દસ્તાવેજ નં.૧૩૦૪માં વધુ વિગતો સ્પષ્ટ કરેલ છે). ચતુ: સીમા - પૂત   | ત                                   |

પ્લોટ નંબર ૨૪, પશ્ચિમ : પ્લોટ નંબર ૧૯ પી એન્ડ રોડ, ઉત્તર:- પ્લોટ નંબર ૧૯ પી, દક્ષિણ - પ્લોટ નંબર ૧૮.

|    | માન્યતા પ્રાપ્ત થવા પર નફો અથવા નુકશાન નફો/<br>(નુકશાન) માટે ફરીથી વર્ગીકૃત કરવામાં આવશે. | -      | -      |        |        | -      |        |
|----|---|--------|--------|--------|--------|--------|--------|
|    | આ વસ્તુઓને લગતી આવકવેરો   | -      | -      |        | -      | -      | -      |
|    | କ୍ରୁଖ ଅन୍ଥ ସ୍ଥାਪ <del>ନ</del> ଆવક (OCI)   | -      | -      | -      | -      | -      | -      |
| 9  | સમયગાળા માટે નફો / (નુકશાન)   | 4.96   | 4.93   | 5.08   | 9.89   | 7.05   | 18.71  |
|    | પેઈડ અપ ઈક્વિટી શેર મૂડી  |        |        |        |        |        |        |
|    | (શેર દીઠ રૂા. ૧૦ ફેસ વેલ્યુ)  | 300.02 | 300.02 | 300.02 | 300.02 | 300.02 | 300.02 |
| 10 | શેર દીઠ કમાણી (EPS) (વાર્ષિક નથી)   |        |        |        |        |        |        |
|    | (૧). પાચાની   | 0.17   | 0.16   | 0.17   | 0.33   | 0.24   | 0.62   |
|    | (૨). પાતળું   | 0.17   | 0.16   | 0.17   | 0.33   | 0.24   | 0.62   |

Place: Ahmedabad

Date: 14-11-2024

સ્થળ : ગુજરાત

- ઉપરોકત નાણાંકીય પરિશામો જે સિકયોરીટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓક ઈન્ડિયા (લિસ્ટિંગ ઓબ્લિગેશન એન્ડ ડિસ્કલોઝર રિકવાયરમેન્ટ) ۹. રેગ્યુલેશન, ૨૦૧૫ ના નિયમન ૩૩ અનુસાર પ્રકાશિત કરવામાં આવ્યાં છે તેની સમીક્ષા કરવામાં આવી છે અને ઓડિટ સમિતિ દ્રારા ભલામણ કરવામાં આવી છે. તા. ૧૩.૧૧.૨૦૨૩, બુધવાર ના રોજ યોજાયેલી મીટીંગ કરી હતી.
- વૈધાનિક ઓડીટર્સ સ્ટેન્ડઅલોન અનઓડિટેડ નાણાંકીય પરિણામોની મર્યાદીત સમીક્ષા હાથ ધરી છે.
- કંપની પાસે માત્ર એક જ બિઝનેશ સેગમેન્ટ છે. અમરનાથ સિક્ચોરીટીઝ લિમીટેડ,

|                    | સહી/-,             |
|--------------------|--------------------|
|                    | નરેશ પધીર,         |
| સ્થળ : અમદાવાદ     | વોલ ટાઈમ ડાચરેકટર, |
| તારીખ : ૧૩.૧૧.૨૦૨૪ | DIN: 08379067      |

#### MEHTA INTEGRATED FINANCE LIMITED CIN: L65910GJ1985PLC007692

Reg. Off: 003, Law Garden Appartment, Scheme-1, Law Garden, Ellisbridge, Ahmedabad – 380006 E-mail : 1mifl\_in@gmail.com • Website: www.mehtaintegratedfinance.com • Ph: 079- 26561000

| Extract of Statememt of Standalone Unaudited Financial Results for |  |             |             |             |            |  |  |  |
|--|--|-------------|-------------|-------------|------------|--|--|--|
|  | the Quarter and Half year ended 30/09/2024 (Rs. In Lakhs except EPS) |             |             |             |            |  |  |  |
| Sr.  | Particulars Quarter ended Quarter ended Haif Year ende               |             |             |             | . ,        |  |  |  |
| No.  |  | 30/09/ 2024 | 30/06/2024  | 30/09/2024  | 31/03/2024 |  |  |  |
|  |  | (Unaudited) | (Unaudited) | (Unaudited) | (Audited)  |  |  |  |
| 1  | Total income from operation(Net)                                     | 24.03       | 20.37       | 44.39       | 210.44     |  |  |  |
|  | Net profit / (loss) for the period                                   | 11.74       | 1.51        | 13.25       | 154.39     |  |  |  |
|  | (before tax, exceptional and / or                                    |             |             |             |            |  |  |  |
| 2  | extraordinary items)   |             |             |             |            |  |  |  |
|  | Net profit / (loss) for the period                                   | 11.74       | 1.51        | 13.25       | 154.39     |  |  |  |
|  | before tax (after exceptional and / or                               |             |             |             |            |  |  |  |
| 3  | extraordinary items)   |             |             |             |            |  |  |  |
|  | Net profit / (loss) for the period after                             | 11.74       | 1.51        | 13.25       | 154.39     |  |  |  |
|  | tax (after exceptional and / or                                      |             |             |             |            |  |  |  |
| 4  | extraordinary items)   |             |             |             |            |  |  |  |
|  | Total Comprehensive Income for the                                   | 11.74       | 1.51        | 13.25       | 154.39     |  |  |  |
|  | period comprising Profit(Loss) and                                   |             |             |             |            |  |  |  |
|  | Other Comprehensive Income for the                                   |             |             |             |            |  |  |  |
| 5  | period (after tax)   |             |             |             |            |  |  |  |
| 6  | Paid up Equity Share Capital(Rs.10/-                                 | 500         | 500         | 500         | 500        |  |  |  |
| 7  | Other Equity   |             |             |             | 1148.68    |  |  |  |
|  | Earning per share (Rs. 10/-each)                                     | 0.23        | 0.03        | 0.265       | 3.09       |  |  |  |
| 8  | Basic and Diluted  |             |             |             |            |  |  |  |
| Note:  | -  |             |             |             |            |  |  |  |

The above is an extract of the detailed format of Unaudited Financial Results for the Quarter and Half Year ended /09/2024 field with Stock Exchange under Rgulation 33 of the SEBI(Listing Obligations & Disclosure Requirements)

gulations, 2015. The full format of the same along with the notes is available on the website of Stock Exchange at www.bseindia.com d at the website of the Company at www.mehtaintegratedfinance.com

For, Mehta Integtated Finance Limited

Date :- 13-11-2024

Place :-Ahmedabad

| Sd/                    |
|------------------------|
| Vishwesh D. Mehta      |
| Managing Director& CFC |
| (DIN: 00484785         |
| (                      |

|       | Extraordinary items)  |          |          |          |          |          |
|-------|---|----------|----------|----------|----------|----------|
| 5     | Total Comprehensive Income for<br>the period[Comprising Profit /<br>(Loss) for the period (after tax)<br>andOther Comprehensive<br>Income(after tax)] | 365.845  | 364.663  | 247.884  | 730.508  | 605.921  |
| 6     | Equity Share Capital  | 1251.520 | 1251.520 | 1251.520 | 1251.520 | 1251.520 |
| 7     | Reserves (excluding Revaluation<br>Reserve) as shown in the<br>Audited/Unaudited Balance Sheet of<br>the previous year *                              | -        | -        | -        | -        | -        |
| 8     | Earnings Per Share (face value of<br>Rs. 10/-each) (for<br>continuing and discontinued<br>operations)   |          |          |          |          |          |
|       | 1. Basic  | 0.292    | 0.291    | 0.198    | 0.584    | 0.483    |
|       | 2. Diluted  | 0.292    | 0.291    | 0.198    | 0.584    | 0.483    |
| Marke |   |          |          |          |          |          |

fter tax (af

 The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) at www.bseindia.com and the listed entity at www.bhatiamobile.com

2. The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approve and taken on record by the Board of Directors at its meeting held on 13th November, 2024.

3. The Limited Review as required under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requiremen Regulations, 2015 has been completed by the auditors of the Company.

Total income from operations includes only revenue from operations, other incomes are not considered.

For Bhatia Communications & Retail (India) Limited

|       | Sa/-   |
|-------|--------|
| nelal | Phatia |

Sanjeev Harbanslal Bhatia Managing Director DIN: 02063671

Date: 13-11-2024 Place: Surat

### ASHISH POLYPLAST LIMITED

Regd.Office: 501, Fortune Business Hub, Nr.Shell Petrol Pump, Science City Road, Ahmedabad-380060 Phone : 9099052582, E-Mail: ashishpolyplast@gmail.com

#### CIN : L17110GJ1994PLC021391

Extract of Statement of Unaudited Financial Results for the Quarter and

| Sr.<br>No. |  | Quarter<br>ended | Six month<br>ended | Quarter<br>ended | Year ended |  |
|------------|--|------------------|--------------------|------------------|------------|--|
|            | Particulars  | 30.09.2024       | 30.09.2024         | 30.09.2023       | 31.03.202  |  |
|            |  | Unaudited        | Unaudited          | Unaudited        | Audited    |  |
| 1          | Total income from operations (net)   | 349.38           | 788.77             | 401.80           | 1,594.13   |  |
| 2          | Net Profit / (Loss) for the period (before Tax,<br>Exceptional and Extraordinary items)  | 40.98            | 86.42              | 18.02            | 97.54      |  |
| 3          | Net profit / (Loss) for the period before Tax (after<br>Exceptional and Extraordinary items)   | 40.98            | 86.42              | 18.02            | 97.54      |  |
| 4          | Net Profit / (Loss) for the period after tax (after<br>Exceptional and Extraordinary items)  | 29.15            | 62.51              | 15.03            | 84.16      |  |
| 5          | Total Comprehensive Income for the period<br>[Comprising Profit / (Loss) for the period (after tax)<br>and Other Comprehensive Income (after tax)] | 27.73            | 61.91              | 14.66            | 83.27      |  |
| 6          | Equity share capital (face value of INR 10)  | 339.75           | 339.75             | 339.75           | 339.75     |  |
| 7          | Reserve excluding Revalution Reserve   |                  |                    |                  | 308.38     |  |
| 8          | Earning per share (before and after extraordinary<br>items)<br>Basic & Diluted :   | 0.86             | 1.84               | 0.44             | 2.48       |  |

The above is an extract of the detailed format of Ouarterly Financial Results filled with the stock exchanges under Regulation 33 of the SEBI (Listing and other Disclosure Requirements) Regulations 2015. The full format of Quarterly Financial Results are available on the Stock Exchange website www.bseindia.com and also on the Company's Website vww.ashishpolyplast.com.

Above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors in their meeting held n November 13, 2024.

| By order of the Board        |
|------------------------------|
| Sd/-                         |
| Ashish D Panchal             |
| Chairman & Managing Director |
| DIN: 00598209                |

અધિકત અધિકારી, ક્લિક્સ કેપિટલ સર્વિસીસ પ્રા.લિ સ્થળ: ગુજરાત, તારીખ: ૧૩.૧૧.૨૦૨૪